



ઇસનપુર પોલીસ સ્ટેશન

અમદાવાદ શહેર

ફોન નં. ૦૭૯- ૨૫૪૩૦૧૮૦

Email.ID-polstn-isanpur-ahd@gujarat.gov.in



PRESS NOTE

રીક્ષામા પેસેન્જરની નજર ચુકવી ઘરેણાની ચોરી કરતી ગેંગને
રૂ.૨૧૦૦૦૦/-ના સોનાના ઘરેણા સાથે પકડી પાડી રામોલ પો.સ્ટેશન
ફ.ગુ.ર.નં ૧૦૪/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯૧૧૪ મુજબનો ગુનો શોધી
કાઢતી ઇસનપુર પોલીસ

મે.પોલીસ કમિશ્નર સા.શ્રી અમદાવાદ શહેર તથા મે.અધિક પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૨ સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ સાહેબ તથા મે.મદદનીશ પો.કમિ.શ્રી “જે” ડીવીજન સાહેબ નાઓ તરફથી મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા વણ શોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અવાર-નવાર સુચનાઓ મળતી હોય જે બાબતે પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એમ.સોલંકી સાહેબ ઇસનપુર પોલીસ સ્ટેશનનાઓના સિધા માર્ગદર્શન અને સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ વી.એન.ભરવાડનાઓ તથા સર્વેલન્સ સ્કોડના માણસો ગઇ તા ૧૧/૦૭/૨૦૧૯ ના રોજ સાંજના સમયે એક બહેન ઘોડાસરથી રીક્ષામા બેસી એક્સપ્રેસ હાઇવે જવા નિકળેલ તે વખતે રીક્ષામા ફરીયાદીની નજર ચુકવી ફરીયાદીના થેલામાથી સોનાના જુદા-જુદા ઘાટના ઘરેણાની ચોરી કરી લઇ ગયેલ જે બાબતેની હકિકત જાણવા મળતા સર્વેલન્સ સ્કોડની એક ટીમે ઘોડાસર ચાર રસ્તાથી સી.ટી.એમ સુધીના સી.સી.ટી.વી ચેક કરતા સી.સી.ટી.વી મા એક શંકાસ્પદ રીક્ષા નં જી.જે-૦૧ ડી.વાય ૧૮૦૩ ની જણાઇ આવતા જે રીક્ષાના માલીક બાબતે તપાસ કરતા રીક્ષા માલીક કુબેરનગરનો હોવાનું જણાતા તેની તપાસ કરતા તેણે પોતે આ રીક્ષા પેઢીમા જમા કરાવી દિધેલ હોય પેઢીમા તપાસ કરતા આ રીક્ષા દાણીલીમડામા વેચેલ હોવાની હકિકત જાણવા મળેલ જેની તપાસમા ચાલુ હતા અને પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા ફરતા હતા દરમિયાનમા ચંડોળા પાળ મહેબુબભાઇના પાર્કિંગ પાસે આવતા સાથેના અ.પો.કો મો.અશરફ ઇસ્માઇલભાઇ તથા અ.પો.કો માનસંગભાઇ ગકલભાઇ નાઓને ઉપરોક્ત નંબરવાળી રીક્ષામા ત્રણ ઇસમો નારોલ તરફથી આવતા હોવાની હકિકત મળતા જે હકિકત આધારે વોચ કરી ઉપરોક્ત રીક્ષામા ત્રણ ઇસમો (૦૧) ઇમરોઝભાઇ ઉર્ફે ચૈયા સ/ઓ અફરોઝભાઇ રંગરેજ ઉ.વ ૩૨ રહેમ.નં ૧૩/એ હરિયાલીનગર ઓકટ્રોય નાકા નારોલ રોડ અમદાવાદ શહેર તથા (૦૨) નાજીરઅલી ઉર્ફે લલ્લા ઉસ્માનઅલી રંગરેજ ઉ.વ ૪૪ રહેમ.નં ૩૧ રક્ષાપાર્ક સોસાયટી એમ.એસ.પબ્લીક સ્કુલની પાસે ત્રીનબત્તી દાણીલીમડા અમદાવાદ શહેર તથા (૦૩) સાકીરભાઇ મુન્નાભાઇ રંગરેજ ઉ.વ ૩૩ રહેમ.નં સી/૬ અલ મુબારક રો-હાઉસ સુલેમાની મસ્જીદની પાછળ ચંડોળા તળાવ પાસે

દાણીલીમડા અમદાવાદ શહેરનાઓને પકડી પાડી તેમની પાસેથી સોનાના જુદા-જુદા ઘાટના ઘરેણા જેમા (૧) એક સોનાનું મંગળસૂત્ર પેન્ડલ સાથેનું જેનું વજન ૨૦.૧૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/-નું તથા (૨)એક સોનાની ચેઇન જેનું વજન ૧૨.૬૧૦ ગ્રામની કિંમત રૂપિયા ૨૫,૦૦૦/-ની તથા (૩) એક સોનાની ચેઇન જેનું વજન ૧૧.૫૮૦ ગ્રામ કિંમત રૂપિયા ૨૫,૦૦૦/-ની તથા (૪)સોનાની કાનશેર નંગ-૨ જેનું વજન ૩.૮૭૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-ની તથા (૫) એક સોનાની વીંટી જેનું ૧.૬૭૦ ગ્રામ કિંમત રૂપિયા ૫,૦૦૦/-ની તથા (૬) એક સોનાની વીંટી જેનું ૧.૯૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૫,૦૦૦/-ની તથા (૭) સોનાની ડાયમંડવાળી બુટ્ટી નંગ-૨ જેનું ૫.૮૬૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૨,૦૦૦/-ની તથા (૮) સોનાની ડાયમંડવાળી બુટ્ટી (બાલી) નંગ-૨ જેનું ૪.૧૧૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-ની તથા (૯) સોનાના મોટા સિક્કા નંગ-૨ જે ૧૬ ગ્રામ વજનના રૂપિયા ૩૦,૦૦૦/-ના તથા (૧૦) સોનાના નાના સિક્કા નંગ-૪ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-ના તથા (૧૧) સોનાના નાના લંબચોરસ સિક્કા નંગ-૨ કિંમત રૂપિયા ૪,૦૦૦/-ના તથા (૧૨) એક કાળા નાના મણકાવાળું સોનાનું પેન્ડલ સાથેનું મંગળસૂત્ર જેનું વજન ૧૬.૩૬૦ ગ્રામ કિંમત રૂપિયા ૩૪,૦૦૦/-નું મળી કુલ રૂપિયા ૨,૧૦,૦૦૦/-નો મુદ્દામાલ તથા સી.એન.જી રીક્ષા નં જી.જે-૦૧ ડી.વાય ૧૮૦૩ કિંમત રૂપિયા ૬૦,૦૦૦/-ની મળી કુલ રૂપિયા ૨,૭૦,૦૦૦/-ની મુદ્દામાલ સાથે પકડી પાડી રામોલ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં ૧૦૪/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુનો શોધી કાઢેલ છે તા ૧૮/૦૭/૨૦૧૯



(જી.એમ.સોલંકી)
પોલીસ ઇન્સપેક્ટર
ઇસનપુર પો.સ્ટેશન
અમદાવાદ શહેર